

સ્વીટકર્નની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ



NAVSARI AGRICULTURAL UNIVERSITY



ડૉ. કે. એ. શાહ અને ડૉ. સી. કે. ટીબડીયા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી – ૩૮૬૪૫૦

સ્વીટકર્નની ખેતી પ્રચલીત થઈ રહેલી ખેતી છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં સ્વીટકર્નની માંગ વધતી જાય છે. સ્વીટકર્નનો ઉપયોગ વિવિધ વાનગીઓ, સુપ, ચાઈનીજ ફૂડમાં બહોળા પ્રમાણમાં થાય છે. તેમજ તેમના ડોડા (મકાઈ) શેક્રીને, બાણીને અને કાચા ઉપયોગમાં લેવાય છે. હરવા–ફરવાના સ્થળ, હોટેલ પર ઘણી ઊંઘી કિંમતે આ મકાઈને લેવામાં આવે છે. સ્વીટકર્નના દાઢા તેના નામ મુજબ દેશી મકાઈ કરતા દાઢા મીઠા હોય છે. આ મીઠાસનું પ્રમાણ દાઢા પૂર્ણ અવસ્થા મેળવે ત્યાં સુધી વધુ હોય છે. સ્વીટકર્ન વાવણી બાદ લગભગ ૭૫ થી ૮૦ દિવસ બાદ તોડવા લાયક થઈ જાય છે. સ્વીટકર્નને ચોમાસા અને શિયાળાનું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. જ્યારે ઉનાળામાં વધુ તાપને કારણે ઘણી વખત પાન બળી જવાની શક્યતા રહે છે. પરંતુ બજાર કિંમત અને માંગને ઘાને રાખી આ મકાઈનું વાવેતર પિયત વિસ્તારમાં બારેમાસ કરી શકાય છે. વધુ ગરમ પવન રોકવા બેતર ફરતી વાનસ્પતિક વાડ કરવી અને નિયમિત જમીનમાં ભેજ જાળવવો જરૂરી બને છે. હવે તો સ્વીટકર્નનું ઉત્પાદન મોટી ફૂડ પ્રોસેસીંગ કરતી કંપનીઓ પણ ખરીદ કરી લે છે અને ગુણવત્તા જાળવવામાં આવે તો ઉત્પાદનની સારી કિંમત પણ મળે છે.

જમીન : સારા નિતારવાળી, મધ્યમકાળી, ગોરાળુ, પૂરતા સેન્દ્રિય પદાર્થ ધરાવતી ભરભરી જમીન મકાઈના પાકને વધુ અનુકૂળ આવે છે. જમીનામાં પાણી ભરાતું હોય તો તેવી જમીનમાં આ પાક સારી રીતે લઈ શકાતો નથી.

જમીનની તૈયારી : ઊડી ખેડ કરી, અગાઉના જડીયા દૂર કરી, મોટા ઢેફા ભાંગવા, સમાર કે ડીસ હેરો મારી જમીન સમતળ તૈયાર કરવી. ભારે કાળી તથા પાણી ભરાતું હોય તેવી જમીનમાં ગાઢી કયારા કે નીક પાળા તૈયાર કરવા.

જાતની પસંદગી : સારી ગુણવત્તા ધરાતવા ડોડા મળે તેવી જાત પસંદ કરવી. હૈદરાબાદથી બહાર પાડેલ "માધુરી" નામની જાતનું બીજ કિંમતમાં સસ્તું હોય સારી કાળજી રાખવાથી આ જાતના ડોડા પણ સારા મેળવી શકાય છે. આ ઉપરાંત ઘણી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા "સ્વીટકોર્ન" ની જુદી જુદી જાતોનું બીજ વેચાણ કરવામાં આવે છે. જે ઘણી ઉચ્ચી કિંમતે બજારમાં મળે છે. સ્ટાનડર્ડ કંપની દ્વારા ઉત્પાદિત થયેલ બીજ પસંદ કરવું. બીજ ખરીદતી વખતે ખાસ તેમની ઉત્પાદન તારીખ અને એક્સપાયરી તારીખ ચકાસી બીજ ખરીદ કરવું. હાલમાં બજારમાં જુદી જુદી કંપનીના સ્વીટકોર્નની જુદી જુદી જાતોના બિયારણ જેવા કે સુગર – ૭૫, અમેરીકન હાઈબ્રિડ સ્વીટકોર્ન, સ્વીટ પર્લ, બાઈટજીન, કોહીનૂર, મધુરામ, મધુમસ્ત, અમૃત વિગેરે ઉપલબ્ધ છે જે વાવી શકાય.

બિયારણનો દર : ૧૦ કિલો પ્રતિ હેક્ટર (૪ કિલો / એકર)

વાવણી સમય : ચોમાસુ : જૂન – જુલાઈ

શિયાળુ : ઓક્ટોબર – નવેમ્બર

ઉનાળુ : ફેઝ્યુઆરી – માર્ચ

વાવણી અંતર : બે ચાસ વચ્ચે ૬૦ સેમી અને બે છોડ વચ્ચે ૨૦ સે.મી. ના અંતરે ૪ થી ૮ સે.મી ઉડાઈએ ૧ બીજ થાણીને વાવણી કરવી જોઈએ. જોડીયા હાર પદ્ધતિમાં ૪૫–૪૫–૮૦ (૪૫ સેમીના અંતરે ત્રણ લાઈન પછી ૮૦ સે.મી જગ્યા છોડી) વાવેતર કરવાથી વચ્ચે વધુ જગ્યા મળવાથી પછીના ખેત કાર્યો સરળતાથી થઈ શકે છે. ઉપરાંત ૨૫ક પિયત પદ્ધતિનો જોડીયા હાર પદ્ધતિમાં ઉપયોગ કરતા ૪૦ ટકા જેટલો લેટરલ લાઈનનો ખર્ચ બચાવી શકાય છે.



બિયારણ માવજત : બિયારણને વાવેતર પહેલા ૧ કિલો બીજ દીઠ ઉ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ જેવી ફૂગનાશક દવાનો પટ ૨૪ કલાક પહેલા આપવો. વાવણીના ૨ કલાક પહેલા ૧ કિલો બીજ દીઠ ૩૦ – ૪૦ મી.લી. એઝેટોબેકર/એઝોસ્પાયરીલમ અને ૩૦ – ૪૦ મી.લી. પી.એસ.બી કલ્યરનો પટ આપી છાંયડે સુકવી વાવેતર કરવું.

પોષણ વ્યવસ્થાપન :

સેન્દ્રિય ખાતર : સ્વીટકોર્નના સારી કવોલીટીના ઉત્પાદન માટે જમીનમાં સેન્દ્રિય પદાર્થ પૂરત પ્રમાણમાં હોવો ખાસ જરૂરી છે. આ માટે પૂર્ણ કોહવાયેલ છાણીયું ખાતર ૮–૧૦ ટન/હેક્ટર અથવા બાયોકમ્પોસ્ટ ૬–૮ ટન/હેક્ટર અથવા અળસિયાનું ખાતર ૫–૬ ટન/હેક્ટર અથવા દિવેલી–લીબોળીનો ખોળ ૧–૨ ટન/હેક્ટર ખેડ કરતી વખતે જમીનમાં બરાબર ભેળવી હેવું.

રાસાયણિક ખાતર : જમીનનું પુશ્થકરણ કરાવી ખૂટતા તત્વો જરૂરી જથ્થામાં આપવામાં આવે તો પરિણામ સારુ મળે છે. પરંતુ તે શક્ય ન હોય તો હાલમાં થયેલ ભલામણ મુજબ ૧૨૦–૬૦–૬૦ કિલો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વ પ્રતિ હેક્ટર આપવું જોઈએ. આમાંથી બધો જ ફોસ્ફરસ અને પોટાશ તથા ત્રીજા ભાગનો નાઈટ્રોજન તત્વોનો જથ્થો વાવણી સમયે પાયામાં આપવો અને બાકી રહેતો નાઈટ્રોજન તત્વોનો જથ્થો બે સરખા ભાગમાં ઢીચણ ઉચ્ચાઈની મકાઈ થયે અને ચમરી નીકળે ત્યારે આપવો.

અ.નં	ખાતર આપવાનો સમય	ડી.એ.બી		યુરિયા		પોટાશ	
		હેક્ટરે	વિઘે	હેક્ટરે	વિઘે	હેક્ટરે	વિઘે
૧	જમીન તૈયાર કરતી વખતે	૧૩૦	૩૨	૩૪	૮	૧૦૦	૨૪
૨	ઢીચણ જેટલી ઉચ્ચાઈની મકાઈ	–	–	૮૭	૨૧	–	–

	થાય ત્યારે (વાવણી બાદ ૨૦ થી ૪૫ દિવસો)					
૩	ચમરી નીકળે ત્યારે (વાવણી બાદ ૪૫ થી ૫૦ દિવસો)			૮૭	૨૧	

ખાલા પૂરવા : વાવણી બાદ ૧૫ દિવસે જે જગ્યાએ બીજ ઉગેલ ન હોય ત્યાં બીજ વાવી પિયત આપવુ. જેથી છોડની પૂરતી સંઘા જળવાય રહે.

આંતર ખેડ અને નિંદણા : પાક સાથે નિંદણ વાવણીના ૩૦ – ૪૦ દિવસ દરમ્યાન હરિશાઈ કરતું હોય જરૂરિયાત મુજબ કરબીથી બે-ત્રણ આંતર ખેડ કરવી. રસાયણિક નિંદણ નિયંત્રણ માટે એટ્રાજીન ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી વાવણી કર્યા બાદ ૧ – ૨ દિવસમાં છંટકાવ કરવો અને ૪૫ દિવસે એક વખત હાથ વઠે નિંદણ કરવુ.

પાળા ચઢાવવા : પાક ઢીયણ સુધી આવે ત્યારે પ્રથમ પૂર્તિ ખાતર આપ્યા બાદ છોડની બાજુમાં પાળા ચઢાવવા જેથી મકાઈના છોડને ટેકો મળી રહે અને મૂળ જમીનમાં ઢંકાયેલા રહે.

પિયત : જરૂરિયાત મુજબ પિયત આપવા. ખાસ કરીને બિયારણના ઝુંબણ અને ઉગાવા સમયે, કૂલ અવસ્થા અને દૂધિયા દાણાની અવસ્થા દરમ્યાન ભેજની ખેચ ન રહે તે રીતે પિયત આપવા. ૨૫ક પદ્ધતિથી પિયત આપવા માટે બાધીભવન દર ધ્યાને લઈ એકાંતરા દિવસે ૦.૫ થી ૨ કલાક પાણી ટપક પદ્ધતિ દ્વારા આપવુ.

પાક સંરક્ષણ :

ગાભમારાની ઈયળ : ગાભમારાના નિયંત્રણ માટે ફ્યુરાડાન ઉ ટકા દવા હેક્ટરે ૮ કિલો પ્રમાણે પાક ૨૦ દિવસનો થાય ત્યારે ભૂંગળીમાં આપવું.

કાતરા : વસ્તી ઓછી હોય તો તે વીણી કેરોસીન વાળા પાણીમાં નંખો જેથી મરી જશે અથવા મિથાઈલ પેરાથીઓન ૨ ટકા અથવા એન્ડોસલ્ફન ૪ ટકા ભુડી હેક્ટરે ૨૫ કિ.ગ્રા પ્રમાણે વાવણી પહેલ જમીનમાં આપવાથી નુકશાન અટકાવી શકાય છે.

લશકરી ઈયળ : આ જીવતાત રાત્રિ દરમ્યાન જ પોતાનો ખોરાક લેવા બહાર નીકળે છે એટલે પાક સંરક્ષણના કોઈ પણ પગલા સાંજના સમયે લેવા વધુ અસરકારક બને છે. આ માટે ૨ ટકા મિથાઈલ પેરાથીઓન પાવડર ૨૫ કિલો/હેક્ટર ડસ્ટરની મદદથી જમીન ઉપર છંટકાવ કરવો.

મોલોમશી : આ જીવતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો કાબૂમાં લેવા માટે રોગર મિથાઈલ – અ – ડીમેટોન, ઈમીડા જેવી સિસ્ટેમીક દવાનો ઉપયોગ કરવાથી કાબૂમાં આવે છે.

કાપણી : સામાન્ય રીતે સ્વીટકર્ન વાવણી બાદ ૭૦ થી ૮૦ દિવસે કાપણી માટે તૈયાર થાય છે. લીલા ડોડામાં મુછીયું આવ્યા બાદ ૧૮ થી ૨૦ દિવસમાં અથવ મુછીયું લીલા રંગમાંથી ઘેરા કથ્થઈ રંગમાં કદલાઈ ત્યારે લીલા ડોડની વીણી કરવી. દાણા બરાબર ભરાયા હોય ત્યારેમકાઈના ડોડા છોડ પરથી તોડવા અને તાત્કાલીક બજારમાં વેચાણ માટે લઈ જવા. વેચાણ માટે લઈ જતા પહેલા ડોડ ઉપરના બગડેલા ૧ – ૨ પાન કાઢ ૧ લેવા જેથી બજાર કિંમત સારી આવે.

ઉત્પાદન : દરેક છોડ દીઠ ૧ થી ૨ મકાઈના ડોડા મળે છે અને દરેકનું વજન ૦.૫ થી ૧.૦ કિલો સુધીનું હોઈ શકે છે. આમ પ્રતિ હેક્ટરે ૮ થી ૧૦ ટન સુધી સ્વીટકર્નના લીલા ડોડાનું ઉત્પાદન મળે છે અને એટલું જ ઉત્પાદન લીલા છોડનું ધાસચારા માટે મળે છે.

